

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦,૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૦/૧/૨૦૧૫ મંગળવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધીધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૩૧/૧૫

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ પર કેસ કરી, ૩૮ વ્યક્તિઓને ઝડપી, ૨૩૬ લીટર દેશી દારૂ અને ૧૧૦ બોટલ ઇગ્લીશ દારૂ કબજે કર્યો હતો.

તકેદારીના પગલાં હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૩૨/૧૫

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલાં હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૯૩ વ્યક્તિઓની અટકાયત કરી હતી.તેમજ પ્રોહી ૯૩ મુજબ ૦૪ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૩ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

અપહરણ:-

સમાચાર યાદી નં. ૧૩૩/૧૫

સાબરમતી : વનિતાબહેન પારજીભાઈ ઠાકોર (ઉ.વ.૧૫)(રહે.શંકરપુરાની ચાલી, ટેલીફોન એક્યુએન્જની સામે, ધર્મનગર, સાબરમતી) ને તા.૧૯/૧/૧૫ સવારનાં ૧૧/૦૦ વાગ્યાના સુમારે ઘર નજીકથી આરોપી કરણ ઠાકોર (રહે.ચાંદખેડા રેલવે સ્ટેશન પાસે, નાકોડા વિસ્તાર) લલચાવી ફોસલાવી જારકર્મ કરવાના ઇરાદે ભગાડી લઈ ગયો છે. આ અંગેની ફરીયાદ વનિતાબહેનનાં પિતા પારજીભાઈ ઠાકોરે સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એ.પી.ચૌધરી ચલાવે છે.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૧૩૪/૧૫

માધવપુરા : મોહમદઇમરાન યાસીનભાઈ અંસારી (રહે.સાગર એવન્યુ, અંબર ટાવર પાસે, જુહાપુર, સરખેજ) એ તા.૧૯/૧/૧૫ નારોજ માધવપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૦/૦૭/૧૩ થી તા.૫/૮/૧૪ દરમ્યાન આરોપી વસીમ ઝહીર અંસારી (રહે.મોહલ્લા લાલ સરાય કસબા ગાવ: બઢાપુર જી.બિજનોર ઉત્તરપ્રદેશ) એ મોહમદઇમરાનને વિશ્વાસમાં લઈ તેમના પુરાવા દસ્તાવેજ આધારે પોતે ક્રેડીટકાર્ડ મેળવી ચેકબુકમાં મોહમદઇમરાનની ખોટી સહી કરી રૂપિયા ૨,૦૦,૦૦૦/- ની છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.ઈ.શ્રી એફ.કે.જોગલ ચલાવે છે.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૧૩૫/૧૫

વસ્ત્રાપુર : અમીતકુમાર સુજયકુમાર ભારદ્વાજ (રહે.સોહમ એવન્યુ, વસ્ત્રાપુર) એ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૬/૧/૧૫ બપોરનાં ૧/૩૦ વાગે પોતે બહારગામ જતી વખતે પોતાના સાળા બલવીંદરસિંગ ગુરૂદયાલસિંગ (રહે.કર્મચારીનગર વિભાગ-૩, ઘાટલોડીયા) ને ઘરની ચાવી આપી હતી. ત્યારબાદ તા.૧૯/૧/૧૫ નાં કલાક ૬/૦૦ વાગે પોતાના ઘરે પરત ફરતાં તેમના સાળા બલવીંદરસિંગ તથા તેનો મિત્ર ચેતન અને તેની પત્નીએ ભેગામળી ઘરની તીજોરીનું તાળુ તોડી સોના-ચાંદીના દાગીના અને ઇલેક્ટ્રોનીક્સ આઇટમો મળી કુલ કિંમત રૂપિયા ૧,૭૧,૭૫૦/- મતાની ચોરી કરી નાસી ગયા હતા. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી જે.બી.રાણા ચલાવે છે.

ચોરીની ફરીયાદ :-

સમાચાર યાદી નં.૧૩૬/૧૫

સરખેજ : શ્યામરાજ પૃથ્વીરાજ ભટ્ટ (રહે.સાણંદ ચોકડી, સરખેજ) એ સરખેજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૯/૧/૧૫ બપોરનાં ૨/૦૦ થી ૮/૦૦ વાગ્યા દરમ્યાન સરખેજ સાગર એસ્ટેટ અંદર ગોડાઉન નંબર-૯ આગળ પાર્ક કરેલ પોતાની ટ્રક નંબર એચ.આર.૩૮.ઓ.૬૫૯૭ ની તાડપત્રી કાપી અજાણી વ્યક્તિ ટ્રકમાંથી કાટુન નંગ-૯૬ કિંમત રૂપિયા ૧,૦૦,૦૦૦/- ચોરી કરી લઇ ગઇ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી ડી.એસ.ઇસરાની ચલાવે છે.

વાહન ચોરી:-

સમાચાર યાદી નં.૧૩૭/૧૫

વટવા : જલપેશકુમાર અરવિંદભાઇ પટેલ (રહે.સિધ્ધેશ્વર પાર્ક સોસાયટી, નિગમ રોડ, ઘોડાસર વટવા) એ તા.૨૧/૧૨/૧૪ નાં કલાક ૪/૦૦ થી ૮/૦૦ વાગ્યા દરમ્યાન પોતાના રહેણાંક નજીક પાર્ક કરેલ પોતાની બોલેરો ગાડી નંબર જીજે.૧.ડી.વી.૨૭૫૨ કિમત રૂપિયા ૫,૫૦,૦૦૦/- ની કોઇ અજાણી વ્યક્તિ ચોરી કરી લઇ ગઇ હતી. આ અંગેની ફરીયાદ જલપેશકુમાર પટેલે તા.૧૯/૧/૧૫ નારોજ વટવા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એચ.સી.ઝાલા ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર
પોલીસ કમિશનર વતી.